

JINDAL HOTELS LIMITED



To,
DCS - CRD
BSE Limited Code No 7918
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400 001

Date: 09.08.2023

Dear Sir,

Scrip Code: 507981

Re: Publication of Unaudited Financial Results of 1st Quarter of FY 2023-24 ended on 30.06.2023 in Newspaper

In compliance with Regulation 47 of the **SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015**, we are enclosing herewith copy of Newspaper cutting relating to Unaudited Financial Results for the 1st quarter of FY 2023-24 ended on 30th June, 2023 published in **Business Standard & Vadodara Samachar** dated 9th August, 2023.

Kindly acknowledge the same.

Thanking You.

For, Jindal Hotels Limited

**Mansi Vyas
Company Secretary**

TJSB SAHAKARI BANK LTD. Gujarat Regional Office : TJSB Sahakari Bank Ltd, G/1-A, ITC Building, Majura Gate Crossing Ring Road, Surat. Tel.: 0261-2460 172-74 E-Mail id :- gujaratregion@tjsb.co.in

NOTICE OF SALE/AUCTION OF PROPERTY "AS IS WHERE IS BASIS AND WHAT IS BASIS"

Bank has initiated recovery action against following defaulted borrower and the Authorized Officer of TJSB Sahakari Bank Ltd., appointed under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and rules made thereunder, has issued a Demand Notice on 10-10-2018 under Section 13(2) of the said Act. The Borrower has not repaid the amount mentioned in the notice within stipulated period, hence the Authorized Officer has taken Physical possession of the mortgage property mentioned below Shop No. 8, & Shop No. 9 on Dt. 08-09-2021 & Flat No. 5 on Dt. 04/07/2023 under Section 13(4) of said Act. I undersigned as the Authorized officer of TJSB Sahakari Bank Ltd; in exercise of powers under the said Act, decided to sale the mentioned property by inviting tenders/offers in sealed cover.

BRANCH- RTM SURAT DETAILS OF THE BORROWER & GUARANTORS DETAILS OF OUTSTANDING DUE.

(1) M/s. Bullfire Tex - A Partnership Firm (Borrower) (2) Mr. Atiq Ahmed Khan - Partner (Borrower & Mortgagor & Guarantor) (3) Mr. Atiq Ahmed Khan - Partner (Borrower & Mortgagor & Guarantor) (4) Mr. Hareeshbhai Bhavanbhai Balar (Mortgagor & Guarantor)

Mr. Piyush Hansrajbhai Balar - Partner (Borrower & Guarantor) (Borrower & Mortgagor & Guarantor) (Borrower & Mortgagor & Guarantor) (Mortgagor & Guarantor)

Shop No. 411, Kohinoor Textile House, Salabatpura, Ring Road, Surat - 395002
Shop No. 8, admeasuring Super Built-Up area 611.00 Sq. feet i.e. equivalent to 56.78 sq. meters on the Ground Floor of the building known and named as 'N. G. Complex'; constructed and situated on the land bearing City Survey Nondh No. 2096 of Ward No. 1, situated in the kasak area of City Bharuch, Taluka: Bharuch, District Bharuch.

Flat No 201 Kudrat Apartments, Seteligh Road, Mota Varachha, Surat - 394101
Flat No 402, B-1 Krishna Park, Near Sudama Chowk, Mota Varachha, Surat - 394101

13(2) Notice dated 10-10-2018, Rs. 1,13,24,570.15 Plus interest thereon and actual Charges. Outstanding due As on 31-07-2023 Rs. 1,86,83,538.88

Details of the Auction to be conducted for Mortgaged Property

Name of property owner: Mr. Atiq Ahmed Khan - Partner (Borrower & Mortgagor & Guarantor) of M/s. Bullfire Tex.

1 All that piece and parcel of the property bearing Shop No. 8, admeasuring Super Built-Up area 611.00 Sq. feet i.e. equivalent to 56.78 sq. meters on the Ground Floor of the building known and named as 'N. G. Complex'; constructed and situated on the land bearing City Survey Nondh No. 2096 of Ward No. 1, situated in the kasak area of City Bharuch, Taluka: Bharuch, District Bharuch.

2 All that piece and parcel of the property bearing Shop No. 9, admeasuring Super Built-Up area 440.00 Sq. feet i.e. equivalent to 40.89 sq. meters on the Ground Floor of the building known and named as 'N. G. Complex'; constructed and situated on the land bearing City Survey Nondh No. 2096 of Ward No. 1, situated in the kasak area of City Bharuch, Taluka: Bharuch, District Bharuch.

3 All that piece and parcel of the property bearing Flat No. 5, admeasuring Super Built-Up area 938.00 Sq. feet i.e. equivalent to 87.17 sq. meters on the 2nd Floor of the building known and named as 'N. G. Complex'; constructed and situated on the land bearing City Survey Nondh No. 2096 of Ward No. 1, situated in the kasak area of City Bharuch, Taluka: Bharuch, District Bharuch.

Physical Possession For Shop No. 8 & 9 Dt. 08/09/2021 & For Flat No. 5 Dt. 04/07/2023

Bid Acceptance And Auction	Place of Auction	Reserve Price	E.M.D	Property Inspection Date and Time	Contact Person Number
On 08/09/2023 Upto 05.00 P.M. Auction On 11/09/2023 @ 12:00 P.M.	Gujarat Regional Office : TJSB Sahakari Bank Ltd, G/1-A, ITC Building, Majura Gate Crossing, Ring Road, Surat	1. Shop No. 8 Rs.6,87,000/- 2. Shop No. 9 Rs.4,57,000/- 3. Flat No. 5 Rs.9,71,000/-	1. Shop No. 8 Rs.68,700/- 2. Shop No. 9 Rs.45,700/- 3. Flat No. 5 Rs.97,100/-	01-09-2023, between 11:00 AM to 5:00 PM	Dipak Solanki 99042 12397

Terms & Conditions :- (1) The above mentioned properties shall be sold on "As is where is basis and what is basis" (2) The aforesaid properties shall not be sold below the reserve price mentioned above. (3) Intending Tenders required to deposit the EMD Stated above by way of order/Demand Draft, Payable at Surat favoring "TJSB Sahakari Bank Ltd." Bidder has also to submit copy of Pan Card and address proof along with EMD. (4) The EMD will not carry any interest. (5) The tender amount along aforesaid EMD should be made in sealed cover super scribed "A) Shop No. 8, 'N. G. Complex', kasak Bharuch; B) Shop No. 9, 'N. G. Complex', kasak Bharuch; C) Flat No. 5, 'N. G. Complex', kasak Bharuch," so as to reach at Office of the Authorized officer Gujarat Regional Office Surat. (6) After opening of the sealed tenders, the tenders/offers may be given an opportunity to enhance the offer price, however, all rights will be reserved with Authorized Officer. The subject sale shall be confirmed in favor of the highest bidder. (7) The said EMD shall be adjusted in the case of successful tenderer/bidder, otherwise refunded on the date of opening the tender itself. (8) The Successful Bidders/Officer shall deposit 25% of the amount of the sale price, Adjusting the EMD immediately, failing which the EMD shall be forfeited. (9) The Balance 75% of the sale price shall be payable on or before 15days confirmation of the sale by the authorized officer. In case failure to deposit this balance amount within prescribed period, the 25% amount deposited shall be forfeited. (10) The Authorized officer has absolute right to accept or reject any or all tenders offers or adjourn, postpone, cancel the auction without assigning any reason thereof. (11) The authorized officer does hereby state that, to the knowledge of the Authorized officer the said property is free from encumbrance. However, the bidder shall ensure by his own sources to find out any charges, lien, encumbrance, property tax, Government dues in respect of the property shall be the responsibility of the tenderers. (12) The successful purchaser would bear the charges, fees, taxes, double stamp duty, Registration fees etc., as applicable as per law. (13) other terms & conditions will be disclose on auction time

This Publication is also 30 days notice to all the borrower / Guarantors/ Mortgagor etc. Authorized Officer, TJSB Sahakari Bank Ltd., Gujarat Regional Office Date: 07-08-2023. Place: Surat.

HLE Glascoat Limited
CIN : L26100GJ1991PLC016173
Website : www.hleglascoat.com

H-106, Phase IV, G.I.D.C., Vithal Udyognagar - 388121. Via Anand, Gujarat.

Extract of Statement of Un-Audited Financial Results for the Quarter ended on June 30, 2023
(Rs. In Lacs except EPS)

Sr. No.	Particulars	Standalone				Consolidated			
		Quarter Ended		Year Ended		Quarter Ended		Year Ended	
		30.06.23	31.03.23	30.06.22	31.03.23	30.06.23	31.03.23	30.06.22	31.03.22
		UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED
1	Total Income from Operation (net)	12649.20	21109.72	14086.31	64946.44	19718.65	29834.18	20442.35	93152.21
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items*)	1054.11	2859.40	1766.14	7221.28	1312.41	3255.98	2181.76	9932.81
3	Net Profit/(Loss) for the period before Tax, (after Exceptional and / or Extraordinary items*)	1054.11	2859.40	1766.14	7221.28	1312.41	3255.98	2181.76	9932.81
4	Net Profit/(Loss) for the period after Tax, (after Exceptional and / or Extraordinary items*)	771.36	2236.54	1302.22	5442.28	929.10	2278.79	1537.81	6980.65
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (loss) for period (after tax) and Other Comprehensive (after tax)	771.52	2251.17	1298.36	5443.04	894.60	2634.25	1533.95	7998.72
6	Equity Share Capital	1365.31	1365.31	1365.31	1365.31	1365.31	1365.31	1365.31	1365.31
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.	-	-	-	-	-	-	-	-
8	Earning Per Share (of Rs 2/- each)								
	a. (from continuing operations)	1.26	3.28	2.00	8.12	1.49	3.34	2.34	10.37
	b. (from discontinuing operations)	1.26	3.28	2.00	8.12	1.49	3.34	2.34	10.37
	Basic Diluted	(0.13) (0.13)	(0.00) (0.00)	(0.09) (0.09)	(0.15) (0.15)	(0.13) (0.13)	(0.00) (0.00)	(0.09) (0.09)	(0.15) (0.15)

NOTES:

1 The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the websites of the Stock Exchange(s): www.bseindia.com, www.nseindia.com and the Company: www.hleglascoat.com

2 The above standalone and consolidated financial results have been reviewed by the Audit Committee and taken on record by the Board of Directors at their Meeting held on 7th August, 2023. These financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 read with the rules thereunder and in terms of the SEBI Circular dated 5th July, 2016.

3 The statutory auditors of the Company have carried out a limited review of the above standalone and consolidated financial results for the quarter ended 30th June, 2023 and has issued an unqualified review report.

4 The Board of Directors had resolved for the closure and winding down of the Chemical Business operations. The performance of the discontinuing operations included in the above results for the quarter ended 30th June, 2023 are as follows:
Total Income ₹ 78.29 lakhs, Expenses ₹ 168.31 lakhs, Loss ₹ (90.02) lakhs, Assets ₹ 1289.47 lakhs, Liabilities ₹ 97.35 lakhs.

5 As per Ind AS-108 "Operating Segments" issued by the Institute of Chartered Accountants of India, if financial results contains standalone financial results and consolidated financial results, no separate disclosure on segment information is required to be given in the standalone financial results. Accordingly, segment information has been disclosed in the Consolidated Financial Results of the Company.

Date : 07th August, 2023
Place : Maroli

For HLE Glascoat Limited
Sd/-
Himanshu Patel
Managing Director

सेन्ट्रल बैंक ऑफ इंडिया
संस्कृत बैंक ऑफ इंडिया
Central Bank of India

RAJKOT REGIONAL OFFICE :
1st Floor, Nagindas Chamber, Dhebar Road, Rajkot.
Mail Id : recoveryrajko@centralbank.co.in

E-AUCTION / SALE NOTICE

E-Auction Sale Notice for sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and guarantor(s) that the below described immovable property mortgaged / charged to the secured creditor, the Physical Possession / Symbolic Possession of which have been taken by the authorized officer of Central Bank of India, Secured creditors, will be sold on "As is where is", "As is what is" and "whatever is there is" basis on 24/08/2023 for recovery of due to the Central Bank of India from Borrower(s) and Guarantor(s). The Reserve Price and earnest money deposit (EMD) is displayed against the details of respective properties.

APPENDIX - IV-A [See proviso to Rule 8(6)] Sale Notice for Sale of Immovable Properties on 24.08.2023

Name of the Borrowers /Guarantors / Mortgagors	Branch Contact Details	Demand Notice Date & Due Amount	Description of the Immovable Property	Reserve Price & EMD 10% & Bid Incremental Amount & Type of Possession
1. M/S. Aero Flexpack Pvt. Ltd. (Pvt. Ltd. Firm), Mr. Bhaveshbhai Shamjibhai Tejani (Director), Mr. Krunal Jaysukhbhai Polara (Director), Mr. Divyesh Rameshbhai Kathiriyi (Director)	Mr Ashok Lakhtaria Branch Manager B/o Jetpur, Dist : Rajkot. Mo. : 96876 90015 Mr Bijana Naik Authorized Officer Mo. 96876 90726	04/07/2022 Rs. 4,62,60,824.00 + Interest + Other Charges thereon.	Plant & Allied Machineries of the Firm : Set - 1 (Physical Possession) Blow Film Plant & Allied Machineries (Supplier - Gurukrupa Moulding) Blow Film Packaging System, with MS structure, with Hopper / Feeding System, with Extrusion Plant, with Take Off Unit, with Inter Bubble Colling System, Control Board Panel, Pneumatic Air Shaft Handling System, Loading and Unloading System, Winding Unit, Mixture Unit etc. ROTO Gravure Printing Machine etc. (Supplier - Mother Industries) ROTO Gravure Printing Machine, with Five Drive System, with Winder, Slitter, Rewinder etc, Installed, Idel, Closed Condition, with Part Loose / Missing Parts Machine with Drive System. Solvent Base Lamination Machine Electrification Electrification - with Transformer, Main / Sub Panel, With Wiring / Cabling, Electric Fitting etc. with Part Loose Condition.	Rs. 118,50,000/- Rs. 11,85,000/- Rs. 50,000/-
2. M/s. Shree Maruti Oil Mill (Partnership Firm) Mr. Rameshbhai Gordhanbhai Savaliya (Partner/ Mortgagor), Mr. Jivrajbhai Bhimjibhai Sojitra (Partner / Mortgagor), Mrs. Anuradha Ranveersinh Parmar (Partner / Mortgagor)	Mr Devendra Kr Pandey Authorised Officer, Jaghnath Plot, Branch, Rajkot Mo. 96876 90039	03/08/2021 Rs. 43,71,518/99 + Interest + Other Charges thereon.	Industrial land & Building in the name of Mr. Rameshbhai Gordhanbhai Savaliya, Mr. Jivrajbhai Bhimjibhai Sojitra, Mrs. Anuradha Ranveersinh Parmar Situated At - Khodalidham Industrial Society, Plot No. 1, R. S. No. 109P, of Vill. : Naranka, Kothariya to Naranka, Nr. Water Tank, At Naranka, Tal. : KotdaSangani, Dist. : Rajkot. Area : 375.74 Sq. Mtrs. North : 18.00 Mtr Wide Road, South : Plot No. 2, East : 10.50 Mtr Wide Road, West : Road Setback. (Physical Possession)	Rs. 33,50,000/- Rs. 3,35,000/- Rs. 50,000/-
3. M/s Balaji Plastic (Proprietor : Mr Sanjay Vithalbhai Virani), Mr. Sanjay Vithalbhai Virani Borrower / Mortgagor, Mr. Dinesh Vallabbhai Kathiriyi - Mortgagor / Guarantor, Mr. Devendra Jivrajbhai Ranpariya - Mortgagor / Guarantor	Mr Divya Jyoti Singhal Authorised Officer, Kalawad Road Branch, Rajkot. Dist. : Rajkot. Mob : 96876 90018	16/02/2019 Rs. 2,53,25,710/- + Interest + Other Charges thereon.	1. Industrial Shed in the name of : Mr. Sanjaybhai Vithalbhai Virani & Mr. Devendrabhai Jivrajbhai Ranpariya Situated At Gujarat State, District Rajkot, Gondal Taluka, Village : Pipaliya, Revenue Survey No. 23 paiki 4 Non Agriculture Land General Industrial Purpose Land known as "Pipaliya Industrial Hub - B" Paiki Plot No. 5. Area : 364.80 Sq. Mt. (Symbolic Possession) 2. Industrial Shed in the name of Mr. Sanjaybhai Vithalbhai Virani Situated at Gujarat State, District : Rajkot, Gondal Taluka, Village: Pipaliya, Revenue Survey No. 23 paiki 4, Non Agriculture Land General Industrial Purpose, Land known as "Pipaliya Industrial Hub - B" Paiki Plot No. 6. Area : 504.68 Sq. Mt. (Symbolic Possession)	Rs. 48,52,000/- Rs. 4,85,200/- 50,000/- Rs. 64,96,000/- Rs. 6,49,600/- Rs. 50,000/-
4. M/s. Matel Plastic (Proprietor : Mrs. Manishaben Nilesbhai Pipaliya 1. M/s Matel Plastic (Proprietorship Firm) - Borrower, Add. 1 : Plot No. 35, Sub Plot No. 35/1, J K Industrial (Green), At Lothada, Add. 2 : Plot No. 4, R. S. No. 467, New Bajrang Industrial At. Padavala, 2. Mrs. Manishaben Nilesbhai Pipaliya-Borrower / Mortgagor (Borrower being Proprietor in M/s Matel Plastic) 3. Mr. Nilesbhai Narshibhai Pipaliya - Guarantor	Mr. Divya Jyoti Singhal Authorised Officer, Kalawad Road Branch, Rajkot. Dist. : Rajkot. Mo. 96876 90018	24/06/2019 Rs. 98,12,059/- + Interest + Other Charges thereon.	1) Industrial Shed in the name of Mrs. Manishaben Nilesbhai Pipaliya, Situated at - R. S. No. 98/1 Paiki 1 Paiki 2, Plot No. 35, Sub Plot No. 35/1, Shed No. 9, "J. K Industrial Green", Nr. Synnera Mattress LLP, Khokhaddad -Kotda Sangani Main Road, Village : Lothada, Tal. : Kotda - Sangani, Dist. : Rajkot. Area : 95.44 Sq. Mt. (Symbolic Possession) 2) Industrial Shed in the name of Matel Plastic Situated at - R. S. No. 467 (Old R.S. No. 199, Plot No. 4, "Matel Plastic", New Bajrang Industrial Area, Nr. Krishna Foundry, Vill. : Padavala, Tal. : Kotda Sangani, Dist. : Rajkot. Area : 399.15 Sq. Mt. (Symbolic Possession)	Rs. 11,76,000/- Rs. 1,17,600/- Rs. 25,000/- Rs. 49,36,000/- Rs. 4,93,600/- Rs. 50,000/-
5. M/S. Maahee Cottex. (Partnership Firm) Partners : 1. Mr. Nitinbhai Chandubhai Khunt (Partner, Mortgagor / Guarantor), 2. Mr. Chandubhai Shambhubhai Khunt (Partner, Mortgagor/ Guarantor), 3. Mr. Rameshbhai Shambhubhai Khunt (Partner, Mortgagor/Guarantor), 4. Mr. Jigneshbhai Rameshbhai Khunt (Partner, Mortgagor/ Guarantor), 5. Mr. Shambhu bhai Shamjibhai Khunt (Guarantor/Mortgagor)	Mr. Prabhakar Nikumbe Babra Branch, Babra, Dist. : Amreli. Mo. 96876 90023 Ms Pooja Jain Authorised Officer, Mo. 96876 90026	04/09/2018 Rs. 4,59,12,939/- + Interest + Other Charges thereon.	1. Factory Land & Factory Building : situated at R. Survey No.113/P, Plot No. 88/1 to 4 and 90/3 to 6, G.I.D.C., Babra - I, Taluka : Babra, Dist. : Amreli, Gujarat - 365 421 in the name of M/S Maahee Cottex, Area : 1720 Sq. Mtrs. (Physical Possession) 2. Industrial Land, Building & Shed situated at R. S. No. 361/P, Plot No. 82/1, Opp. Maahee Cottex, G.I.D.C., Babra - I, B/H BPCL Petrol Pump, Taluka : Babra, Dist. : Amreli Property in the name of Mr. Nitinbhai Chandubhai Khunt. Area : 215.00 Sq. Mtrs. (Physical Possession)	Rs. 47,56,500/- Rs. 4,75,650/- 50,000/- Rs. 4,88,250/- Rs. 48,825/- Rs. 10,000/-

Date of E-Auction : 24/08/2023 • Time - 12.00 Noon to 5.00 PM with Auto extension of 10 Minutes.
Date of Inspection & Time : 21/08/2023 Between 12.00 Noon to 5.00 PM

Bidder will register on website <https://mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp> and upload KYC documents and after verification of KYC documents by the service provider, EMD to Be Deposited in Global EMD wallet through NEFT/RTGS/transfer (after generation of challan from <https://mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp>)
The auction will be conducted through the Bank's approved service provider "https://www.mstcecommerce.com"

E - Auction will be held "As is where is", "As is what is" and "whatever is there is" basis. For detailed terms and conditions please refer to the link provided in www.centralbankofindia.co.in secured creditor or <https://www.ibapi.in> or auction platform for auction related educational videos (<https://mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp>). MSTC Helpline No. : 033-22901004

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER RULE 8(6) OF THE SARFAESI ACT, 2002
Borrowers/Guarantors/ Mortgagors are hereby notified to pay the sum as mentioned above along with up to date interest and ancillary expenses before the date of e-auction, failing which the property will be auctioned/sold and balance dues, if any, will be recovered with interest and cost.
Date : 09.08.2023, Place : Rajkot

Sd/- Authorised Officer, Central Bank of India

SYMBOLIC POSSESSION NOTICE

ICICI Bank Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra- 400604

Whereas
The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.
As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower/ Loan Account Number	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs.)	Name of Branch
1.	M/s. Amrut Trading Co. & Mr. Kishanbhai Narshibhai Sakhrelia, Mrs. Lataben Kishanbhai Sakhrelia & Mr. Jay Kishanbhai Sakhrelia-084805000668 & 084855000001	Plot No. 4/A/1, Jivandeep Society, Revenue Survey No. 435/6, Registration Sub-District & District Rajkot, Gujarat / August 03, 2023	April 28, 2023/ Rs. 3,75,97,989.01/-	Rajkot

The above-mentioned borrowers(s)/ guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.
Date: August 09, 2023
Place: Rajkot

Authorized Officer
ICICI Bank Limited

SYMBOLIC POSSESSION NOTICE

ICICI Bank Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra- 400604

Whereas
The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.
As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower/ Loan Account Number	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs.)	Name of Branch
1.	M/s. Mahavir Galvanizers & Mr. Amitkumar Mahavirsinh Chauhan alis Mr. Amit Mahavirsinh Chauhan, Mr. Sunil Mahavirsinh Chauhan & Mrs. Sonam Amit Chauhan-341005000603	Property -1) Shop No. 01, Ground Floor, Tower-A, Vraj Residency, Revenue Survey No. 198 & 203, City Survey No. 666 & 667, Village Mouje Makarpura, Registration District & Sub District Vadodara Division-6 (Maneja), Gujarat Property -2) Flat No. B-408, Fourth Floor, Tower-B, Vraj Residency, Revenue Survey No. 198 & 203, City Survey No. 666 & 667, Village Mouje Makarpura, Registration District & Sub District Vadodara Division-6 (Maneja), Gujarat/ August 04, 2023	April 29, 2023/ Rs. 39,73,091.50/-	Vadodara
2.	Kew Fusegear Pvt Ltd & Mr. Chandresh Natterval Shah, Mr. Amit Natterval Shah, Mr. Amish Maheshbhai Shah, Mr. Shashin Nayan Shah, Mr. Dhaval Shah & Mr. Harsh Shah-085355000019 & 431251000002 & 431255000023	Shed No. C1B-336/37 & 38, Makarpura Industrial Estate, Revenue Survey No. 601/P, Within Village Limit of Vadsar, Taluka & District Vadodara / August 04, 2023	April 28, 2023/ Rs. 5,62,81,741.51/-	Vadodara

The above-mentioned borrowers(s)/ guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.
Date: August 09, 2023
Place: Vadodara

Authorized Officer
ICICI Bank Limited

JINDAL HOTELS LIMITED
(CIN No. : L18119GJ1984PLC006922)
Registered Office : Grand Mercure Vadodara Surya Palace, Sayajigunj, Vadodara - 390 020.
Tel : 0265 - 2363366 Fax : 0265 - 2363388 Email : share@suryapalace.com Website : www.suryapalace.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30.06.2023
(₹ in Lacs)

Particulars	For the Quarter ended 30.06.2023	For the Quarter ended 30.06.2022	For the Year ended 31.03.2023
1 Revenue from operations	900.51	994.89	4,139.07
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	(25.56)	1.71	163.07
3 Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	(25.56)	1.71	163.07
4 Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	(21.31)	0.71	206.82
5 Total Comprehensive Income for the period (comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	0.16	0.00	0.62
6 Equity Share Capital	700.00	700.00	700.00
7 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	1,186.41
8 Earnings per share (of ₹ 10/- each) Basic & Diluted (Rs.)	(0.30)	0.01	2.95

Notes : 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results of 1st Quarter ended on 30.06.2023, filed with the BSE u/s 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Result is available on the Company's Website at www.suryapalace.com and the BSE Website (URL of Filings) www.bseindia.com.
2. The above unaudited results have been reviewed by the Audit Committee and approved by Board of Directors in their meeting held on 08.08.2023.

For JINDAL HOTELS LIMITED
Piyush D. Shah
Managing Director (DIN : 00010884)

Date : 08th August, 2023
Place : Vadodara

